

ORIENTAL CARBON & CHEMICALS LIMITED

14th Floor, Tower-B, World Trade Tower, Plot No. C-1, Sector-16, Noida -201301, UP
Phone : 91-120-2446850, Email: investors@agventures.co.in
Website: www.agventuresltd.com

September 24, 2024

The Manager
BSE Limited
Department of Corporate Services,
Floor 25, P. J. Towers, Dalal Street
Mumbai - 400 001

The Manager
National Stock Exchange of India Ltd.
Exchange Plaza, Bandra Kurla Complex
Bandra (E),
Mumbai - 400 051

Scrip Code: 506579

Symbol: OCCL

Dear Sir/Madam,

Sub: Submission of notice to the shareholders of the Company in respect of transfer of Equity Shares/Dividend to the Investor Education and Protection Fund

In compliance with Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed e-copies of public notice published on September 24, 2024, in respect of transfer of Equity Shares of the Company to the Investor Education and Protection Fund in accordance with the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended from time to time, in the "Financial Express" (All Edition in English) and "Sandesh" (Bhuj Edition in Gujarati).

This is for your information and record.

Thanking you,

Yours faithfully,
For **Oriental Carbon & Chemicals Limited**

Gourab Kumar Nayak
Company Secretary

Registered Office :
Plot No. 30 - 33, Survey No. 77
Nishant Park, Nana Kapaya,
Mundra, Kachchh,
Gujarat -370415
CIN - L24297GJ1978PLC133845

Report on EY staffer death in 10 days: Mandaviya

PRIYANSH VERMA
New Delhi, September 23

LABOUR MINISTER MANSUKH MANDAVIYA on Monday said investigation is underway into the alleged "unsafe and exploitative work environment" that is said to have caused EY staffer Anna Sebastian Perayil's death, and the report is expected in 10 days.

The state authorities are preparing a report on the incident. "We will have to study the results of the report... We'll be able to tell more about it when the report comes," Mandaviya said. "The post mortem report will come, the police will give a report. We'll speak with the company also, and take any action based on the findings of the reports," he said.

On July 20, 26-year-old Anna Sebastian Perayil, a chartered accountant from Kerala, who was an employee of SR Batliboi, a member firm of EY Global, passed away due to alleged "work stress" (as claimed by her mother). She was posted in Pune.

"Deeply saddened by the tragic loss of Anna Sebastian Perayil. A thorough investigation into the allegations of an

MANSUKH MANDAVIYA, UNION LABOUR MINISTER

THE POST MORTEM REPORT WILL COME, THE POLICE WILL GIVE A REPORT. WE'LL SPEAK WITH THE COMPANY ALSO, AND TAKE ANY ACTION BASED ON THE FINDINGS OF THE REPORTS



unsafe and exploitative work environment is underway. We are committed to ensuring justice and the labour ministry has officially taken up the complaint," Union minister of state Shobha Karandlaje said on X last week.

Anna's mother sent a mail to EY India chairman Rajiv Memani, where she criticised the company's work culture and highlighted the absence of any employee of the company at the deceased's funeral.

Last week, in a LinkedIn post, Memani expressed regret for not attending Anna's funeral and said that he is "committed to nurturing a harmonious workplace".

"We are deeply saddened by Anna Sebastian's tragic and untimely passing in July 2024," EY said in a statement released last week. Since the death, EY has been in touch with the family, helping them, but it is only now that her family has chosen to write to the company, complaining about the "excessive workload", it said.

EY has said it will continue to improve and provide a healthy workplace in its offices throughout the country. The company has also said while no measure can compensate for the loss experienced by the family, the firm has provided all the assistance and will continue to do so. (With PTI inputs)

FM says 'no way' victim shaming was done or intended

FACING FLAK FOR her comments on the death of a young chartered accountant employed with EY allegedly due to work pressure, finance minister Nirmala Sitharaman on Monday clarified that she had not shamed the victim in any way and her comments were neither intended to do so.

In a post on X, Sitharaman said: "With a sense of grief over the tragic loss, I highlighted the importance of institutions and families to support the children, and in no way victim shaming was done nor intended, even remotely." The Union labour ministry has already assured a thorough investigation into the allegations of an exploitative work environment related to the tragic demise, she said.

Addressing an event on Saturday, Sitharaman had referred to the death of the 26-year-old woman, without naming the victim or the company. —PTI

Is Gill ready now to sit on the throne of games?

VENKATA KRISHNA B
Chennai, September 23

THE SHOWMAN'S BOW from Shubman Gill on reaching a hundred is a sight that Indian cricket is beginning to get used to. When he bows, one can't help but appreciate the aesthetic exhibition he has put on. Last February, though, all that had gone missing.

Having taken up the No 3 slot voluntarily since the tour of West Indies in 2023, Gill had gone 10 consecutive innings without even touching 40. Issues had cropped up: A semi-frozen front-foot had led to problems against nipbackers from pacers and curiously, some issues had popped up against spin too. A certain lack of trust in his defence.

For a batsman, who never went through three straight innings in age-group cricket without a big score, the failures were only putting additional pressure. Not even a century would get rid of FOMO. "I felt disconnected with the sport at one point. Even when I was doing well, I wasn't feeling great. I would feel I had missed out on the last three-four games, that I had to do well in the next four games. And the joy in doing well in that one game was missing. I wasn't enjoying the good thing," Gill had said back in May.

Despite scoring a coming-of-age century in the second innings at Vizag against England this year, the showman's bow was nowhere to be seen. But weeks later it was back in Dharamshala. And last week, it was on display again in Chennai against Bangladesh. After being caught down the leg-side in the first innings, Gill's century in the second innings was by far his most fluent one in recent times. The bowling hardly challenged him. Such occasions can lead to boredom among batsmen. But No 3s, the engine of the batting units,



usually don't have that luxury.

There is every reason to believe more hundreds are lined up, but more importantly India's No 3 is beginning to repay the faith. There were enough indications that Gill has put work behind the scenes, especially to improve his game against the spinners as well his troubles against the in-swingers. In his brief career, spinners have troubled both his edges, especially the outside one. Despite having a long reach to smother the turn, Gill's tentativeness and lack of trust in his own defence has seen him make repeated mistakes.

Since that innings in Vizag, Gill has been a different batsman. He is assured in defence

and when he wants to attack with his feet and keep the ball on ground and hit in the air. "Yeah, actually it's something that I started practicing when I was very young," Gill said about using his feet against spinners.

"Because I was always a tall guy, it was easier for me to use my feet and play along the ground. Playing in the air and hitting sixes actually came a bit later when I got a little bit more power in my body. Initially when I used to practice, especially against spinners, it used to be a lot more me stepping down trying to rotate. Because it's then hard for bowlers to settle on a wicket like this where the odd one is turning but not

all balls," Gill said after scoring his century here.

And more than his game against the spinners, it is his aggressive intent that has made the previous team management under head coach Rahul Dravid back Gill for the No 3 role. Especially on away tours, India's think-tank had seen a pattern, where they were getting stuck on challenging decks and wanted stroke-making No 3 as they moved on from Cheteshwar Pujara.

With a unique technique, which didn't necessarily fit into the textbook, there were reasons to back Gill's methods. Having been brought up playing cricket on cement decks, Gill has a strong back-foot game as well as horizontal bat shots. And more importantly, with a unique bat swing, his slices on either side had the ability to neutralise deliveries that most others would be content seeing off. It is no surprise that India saw a run-machine in Gill.

And Gill saw the opportunity to be one. After all, as a teenager, he was used to logging onto the Cricket Archive website to check what scores Virat Kohli used to make at his age. He was never short of ambition; but perhaps the desire to get there soon had boiled over a bit too much to affect his own appreciation of the game until he made course corrections.

As Gill has grown into his new role, he has another 8 more innings at home before the big test awaits in Australia. In his maiden tour Down Under in 2020/21, Gill had announced his arrival in a grand manner, with his 91 during the chase at Gabba setting up a famous win. Since then Gill has only grown from strength-to-strength, and is touted as the Prince, who is waiting for the coronation. This season will give a definite answer as to how soon Gill sits on the throne.

Laapataa Ladies India's official entry to Oscars

ALAKA SAHANI
Mumbai, September 23

ENDING SPECULATIONS OVER India's official entry for the best foreign film category at the 97th Academy Awards, the Film Federation of India (FFI) on Monday selected Kiran Rao-directed *Laapataa Ladies* for submission.

Expressing her gratitude to "the selection panel and everyone who believed in the film", Rao in her social media post wrote: "It is indeed a great privilege to be selected from among



such amazing Indian films this year — who are equally worthy contenders for this honour."

Laapataa Ladies tells the coming-of-age story of two newlywed brides, who are mis-

takenly exchanged during a train ride to their in-law's homes. The film produced by Aamir Khan Productions emerged as the top choice for India's Oscar entry out of 29

movies which were under consideration. Khan in a statement said he was "proud of Kiran and her entire team" and hoped that the film would be "able to win the hearts of the members of the Academy".

The announcement by FFI, which is entrusted to make the selection, was lauded by many while others expressed their surprise over Payal Kapadia-directed *All We Imagine As Light*, the winner of Grand Prix at the Cannes Film Festival earlier this year, being overlooked.

TATA POWER
(Corporate Contracts Department, 5th Floor Station B)
Tata Power, Trombay Thermal Power Station Chembur-Mahul, Mumbai 400074, Maharashtra, India.
(Board Line: 022-67175323, Mobile: 7208817950) CIN: L28920MH1919PLC000567

NOTICE INVITING TENDER

The Tata Power Company Limited invites tender from eligible vendors for the following package:
Obtaining Transferable Development Rights at Chembur Tata Colony Mumbai Mumbai-400074

For detail NIT, please visit Tender section on website <https://www.tatapower.com>. Last date for receipt of request for issue of bid document is 5th October 2024.

KMF Karnataka Cooperative Milk Producers' Federation Limited
Kmf Complex, Dr. M.H. Marigowda Road, Bangalore - 560 029
Phone : 26096832 / 910 Fax : 080-25536105
E-mail : purchase@kmf.coop

IFT No. KMF/PUR/Tender-692/2024-25 Date: 23.09.2024

TENDER NOTIFICATION
(Through KPP Portal)

The Karnataka Milk Federation Ltd., Bangalore invites tenders from eligible tenderers for providing services for the following item:

Sl. No.	Name of the service	Quantity	EMD (Rs.)
01	Providing Hoarding service to KMF for a period of six months	Single job work as detailed in tender document	1,45,000/-

Tender Document may be downloaded from e-procurement website <http://kppp.karnataka.gov.in>

Date of commencement of Tender : From 24.09.2024. Pre-bid Meeting Date : 01.10.2024 at 11.00 AM. Last date for Uploading of Tender : on or before 08.10.2024 up to 5.00 PM. Date of opening of Tech. Tender : on 10.10.2024 at 11.00 AM. Date of Commercial bid opening : After technical evaluation.

Other details can be seen in the tender documents.

For Karnataka Co-Op. Milk Federation Ltd.,
Sd/- DIRECTOR (PURCHASE)

ASSAM POWER DISTRIBUTION COMPANY LIMITED
(A Govt. of Assam Public Limited Company)

NOTICE INVITING TENDER
NIT No.: APDCL/CGM (RE)/PMA/RDSS (Addl. HH)-01/2024

Bids are invited from eligible bidders for single stage two envelopes bid for "Engagement of Consultancy Services for assisting and supporting in Project Management to Assam Power Distribution Company Limited (APDCL) for electrification of un-electrified households in the State of Assam under Revamped Referrals Linked Results Based Distribution Sector Scheme (RDSS)".

Interested bidders will be able to view & download the detailed bidding documents in the website of APDCL www.apdcl.org & <https://www.assamtenders.gov.in>, the e-Procurement System of Govt. of Assam w.e.f. 24.09.2024. Interested Bidders are required to create their own user ID & password in the e-tendering portal, if not created earlier.

Schedule to the Invitation of tender:

1. Bid validity : 180 days from the last date of submission of Bid.
2. Publishing & Download of Bid : 1700 Hrs. of 24.09.2024
3. Pre-bid Meeting : 1200 Hrs. of 26.09.2024
4. Starting Date of submission of Bid : 1100 Hrs. of 27.09.2024
5. Last Date of submission of Bid : 1600 Hrs. of 03.10.2024
6. Date of Bid opening : 1400 Hrs. of 04.10.2024

The prospective bidders are required to have their "Digital Signature" (both signing & encryption) for participating in the e-tendering. Interested bidders can contact the office of the CGM (RE), APDCL, for necessary assistance.

N.B. Undersigned reserves the right to change/modify/cancel the notification without assigning any reason thereof.

Sd/- Chief General Manager (RE), APDCL,
Bijulee Bhawan (Annex Building), Paltanbazar,
Guwahati-781001 (Assam), E-mail: cmre.aseb@gmail.com

Please pay your energy bill on time and help us to serve you better!

CORDS Cords Cable Industries Limited
Registered Office: 94, 1st Floor, Shambhu Dayal Bagh Marg,
Near Okhla Industrial Area Phase-III, Old Ishwar Nagar, New Delhi-110020
Tel: 011-40551200 * Fax: 011-20887232 * E-mail: cdl@cordscable.com
website: www.cordscable.com * CIN: L74999DL1991PLC046092

NOTICE

Pursuant to the provisions of SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015 and Company's Code for prevention of Insider Trading, the Trading Window for dealing in the Securities of the Company shall remain closed from Tuesday, 01st October, 2024 for the Directors, Designated Employees, Insiders and their immediate relatives till 48 hours after the un-audited Financial Results for the 2nd quarter 6 months ended on 30th September, 2024 is made public.

Accordingly, all designated persons; Directors; promoters; persons acting in concert; employees of the Company along with their respective immediate relatives; persons having contractual and fiduciary relation with the Company including but not limited to Auditors, accountancy firm, law firms, analysts, consultants, etc., assisting or advising the Company, shall not involve in any transaction for dealing/trading in the securities of the Company during the period when Trading Window is closed.

By Order of Board of Directors
For Cords Cable Industries Limited
Sd/-
Garima Pant
Company Secretary

Place: New Delhi
Date: September 23rd 2024

FORM G
INVITATION FOR EXPRESSION OF INTEREST FOR
LAVASA CORPORATION LIMITED, VARASGAON ASSETS MAINTENANCE LIMITED, DASVE CONVENTION CENTER LIMITED, VARASGAON POWER SUPPLY LIMITED AND DASVE RETAIL LIMITED OPERATING IN REAL ESTATE AND HOSPITALITY SECTOR AT LAVASA, PUNE, MAHARASHTRA
[Under sub-regulation (1) of regulation 36A of the Insolvency and Bankruptcy Code 2016 India (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016]

SL.	RELEVANT PARTICULARS	Name	PAN	CIN
1.	Name of the corporate debtor along with PAN/ CIN/ LLP No.	Lavasa Corporation Limited Varasgaon Assets Maintenance Limited Dasve Convention Center Limited Varasgaon Power Supply Limited Dasve Retail Limited	AABC14435E AABW1179L AACC09569D AACA09515D AACC00058P	U55101MH2000PLC187834 U74999MH2011PLC219078 U70101MH2008PLC185945 U40101MH2010PLC200845 U51109MH2008PLC187367
2.	Address of the registered office	Hincon House, Lal Bahadur Shastri Marg, Vikhroli West, Mumbai, MH 400083, India		
3.	URL of website	http://www.lavasa.com		
4.	Details of place where majority of fixed assets are located	Lavasa, Pune, Maharashtra Please refer Detailed EOI available on http://www.lavasa.com		
5.	Installed capacity of main products/ services	Corporate Debtors have major assets as Real Estate projects, retail spaces, convention centre and city management services in Lavasa city. Please refer Detailed EOI available on http://www.lavasa.com		
6.	Quantity and value of main products/ services sold in last financial year	Please refer Detailed EOI available on http://www.lavasa.com		
7.	Number of employees/workmen	Employee count: 28, as of August 2024 Please refer Detailed EOI available on http://www.lavasa.com		
8.	Further details including last available financial statements (with schedules) of two years, lists of creditors are available at URL	http://www.lavasa.com		
9.	Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at URL	http://www.lavasa.com		
10.	Last date for receipt of expression of interest	09 th October 2024*		
11.	Date of issue of provisional list of prospective resolution applicants	14 th October 2024*		
12.	Last date for submission of objections to provisional list	19 th October 2024*		
13.	Date of issue of final list of prospective resolution applicants	24 th October 2024*		
14.	Date of issue of information memorandum, evaluation matrix and request for resolution plans to prospective resolution applicants	29 th October 2024*		
15.	Last date for submission of resolution plans	28 th December 2024*		
16.	Process email id to submit Expression of Interest	inlavasip@deloitte.com		

* The timelines as stated above remain subject to modification by the COC, and any extension/ exclusion to the timelines for completion of CIRP of the Corporate Debtor under Insolvency & Bankruptcy Code 2016 read with the applicable rules and regulations. Interested parties are requested to refer to website of Lavasa Corporation Limited <http://www.lavasa.com> from time to time, for any change in the timelines mentioned above.

Sd/-
Shallesh Verma
Date: 24 September 2024
Registered Address: E1004, Vijay Apartment, Mail Road, Ahinsa Khand 2, Indrapuram (Ghazalbad), 201014
Registered Email: shallesh3108@gmail.com
Communication Address: Deloitte India Insolvency Professionals LLP,
32nd Floor, Tower 3, One International Center, Elphinstone - West, Mumbai - 400013; Email: inlavasip@deloitte.com; shaivesma@deloitte.com
For Lavasa Corporation Limited,
Varasgaon Assets Maintenance Limited, Dasve Convention Center Limited,
Varasgaon Power Supply Limited & Dasve Retail Limited

TATA POWER
(Corporate Contracts Department, 5th Floor Station B)
Tata Power, Trombay Thermal Power Station Chembur-Mahul, Mumbai 400074, Maharashtra, India.
(Board Line: 022-67175323, Mobile: 7208817950) CIN: L28920MH1919PLC000567

NOTICE INVITING TENDER

The Tata Power Company Limited invites tender from eligible vendors for the following package:
OLA for Garden Maintenance Work and Cleaning of Common places in Powerhouse area at Bhivpuri for 3 years

For detail NIT, please visit Tender section on website <https://www.tatapower.com>. Last date for receipt of request for issue of bid document is 5th October 2024.

OCCL
ORIENTAL CARBON & CHEMICALS LIMITED
Corporate Identity Number (CIN) - L24297GJ1978PLC133845
Regd. Off: Plot No. 30-33, Survey No.77, Nishant Pak,
Nana Kapaya, Mundra, Kachchh, Gujarat - 370415
Email ID: investors@agventures.co.in, Tel: +91 120 2446850
Website: www.agventuresltd.com

NOTICE
(for attention of Equity Members of the Company)

Sub.: Transfer of Equity Shares of the Company to the Investor Education and Protection Fund Authority (IEPF)

This Notice is hereby published pursuant to the provisions of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time ("the IEPF Rules"). As per Section 124(6) of the Companies Act, 2013 read with the above referred Rules, all shares in respect of which dividends declared by the Company has not been claimed or remained unpaid for seven consecutive years or more since the payment of interim dividend for the financial year 2017-18 are liable to be transferred by the Company to the Investor Education and Protection Fund (IEPF).

In accordance with the various requirements as set out in the Rules, the Company has already communicated individually to the Members that equity shares in respect of which dividend declared for the financial year 2017-18 (Interim Dividend) has not been claimed or remained unpaid for seven consecutive years or more will be transferred to the Demat Account of the IEPF Authority. The Company has uploaded full details of such Members and shares due for transfer to the IEPF Authority on the website of the Company at www.agventuresltd.com.

All concerned members are further requested to encash the Interim Dividend for the financial year 2017-18 and onwards by providing requisite documents to the Company or Company's Registrar and Share Transfer Agent on or before 30th December 2024 so that the shares and/or dividend are not transferred to the IEPF. In case the Company or the Registrar and Share Transfer Agent of the Company does not receive any communication within aforesaid period, the Company shall, with a view to complying with the requirement set out in the Rules, transfer the entire shares to IEPF, without any further notice by the following due process as mentioned below:

- In case of shares held in Physical form: by issuing duplicate share certificates on behalf of the concerned members and then transferring the same to IEPF Authority.
- In case of shares held in Demat form: by transferring the shares directly to demat account of IEPF Authority with the help of Depository Participants.

Concerned Members can claim both unclaimed dividend and shares transferred to the IEPF Authority after following the procedure prescribed in the IEPF Rules.

In case the Members have any queries/clarifications on the subject matter and the Rules, they may contact the Registrar and Transfer Agent of the Company at Link Intime India Pvt. Ltd., Rasoi Court, 5th Floor, 20, Sir R N Mukherjee Road, Kolkata - 700001, West Bengal, Tel: +91 33 4004 9728/1698; E-mail: rt.helpdesk@linkintime.co.in.

The Notice may also be assessed on the Company's website at www.agventuresltd.com and may also be assessed on Stock Exchanges Websites at www.bseindia.com and www.nseindia.com.

For Oriental Carbon & Chemicals Limited
Sd/-
Gourab Kumar Nayak
Company Secretary

Place: Noida
Dated : 23.09.2024

NOTICE OF LOSS OF SHARES OF HUL
(Formerly Hindustan Lever Limited)
Regd. Off. Hindustan Unilever Limited, Unilever House
B D Savant Marg, Chakala, Andheri (East), Mumbai - 400 999

Notice is hereby given that the following share certificates have been reported as lost/misplaced and the Company intends to issue duplicate certificates in lieu thereof, in due course.
Any person who has a valid claim on the said shares should lodge such claim with the Company at its Registered Office within 15 days hereof.

Name of the Holder	Folio No.	No. of shares (Rs. 1/-)	Certificate No.(s)	Distinctive No.(s)
BINAY KUMAR MANGLIK	HLL2851492	220	5209759	1029519201 - 1029519420

Place : Mumbai, Maharashtra Date : 24-09-2024

PI Industries Limited
CIN: L24211RJ1946PLC000469
Regd. Office: Udaigar Road, Udaipur - 313 001 (Raj.)
Phone: 0294-6651100, Fax: 0294-2491946
E-mail: investor@pind.com, Website: www.pindustries.com

NOTICE TO EQUITY SHAREHOLDERS OF THE COMPANY - TRANSFER OF EQUITY SHARES TO INVESTOR EDUCATION & PROTECTION FUND (IEPF)

This Notice is published pursuant to the provisions of the Companies Act, 2013 ("the Act") read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules"). The Equity Shareholders of PI Industries Limited ("the Company") are hereby informed that in accordance with the provisions of Section 124(6) of the Act read with Rule 6 of the Rules, the Interim dividend declared by the Company during the financial year 2017-18 lying unpaid/unclaimed for a period of seven consecutive years or more will be transferred to IEPF within 30 days from the due date i.e. 29 November 2024. Further, shares held by the shareholders who have not encashed the dividend for the year 2017-18, and who have not encashed any dividend warrant during last seven years, will also be transferred to IEPF as per the procedure set out in the Rules. Details of such dividend and shares transfer are available on the website of the Company viz. <https://www.pindustries.com/investor-relations/sh-cg/Shareholders-Information>. All benefits accruing on such shares, if any, shall also be transferred to IEPF in compliance with the Rules.

The shareholders may claim the shares transferred to IEPF along with benefits accrued thereon, from time to time, after following the procedure laid down in the Rules. Please note that no such claim shall lie against the Company with respect to the unclaimed/unpaid dividends and share(s) transferred to the IEPF pursuant to the Rules. The Company has communicated by email where email address is available and by post where e-mail address is not recorded with Company, to those shareholders whose shares/unpaid dividend are liable to be transferred to IEPF under the said Rules.

In this connection, please note the following:

1. In case the shares are held in physical form: The Company would be issuing Letter of Confirmation (LOC) in lieu of the original share certificate(s) for transferring said shares to IEPF and the said original share certificate(s) will stand automatically cancelled and be deemed non-negotiable. After issue of LOC, the Company shall inform the depository by way of corporate action to convert such physical share into demat form and transfer in favour of IEPF Authority.
2. In case the shares are held in demat form: The Company shall inform the depository by way of corporate action, for transferring such shares to IEPF Authority.

The shareholders may note that in terms of Section 124(6) of the Act read with the IEPF Rules, in the event of transfer of shares and unclaimed dividends to IEPF, concerned shareholders are entitled to claim the same by making a request to the Company or KFin Technologies Limited (RTA) for issuance of 'Entitlement Letter' and thereafter on obtaining the same, file an online application in E-Form No. IEPF-5 available on the website at www.iepf.gov.in along with the 'Entitlement Letter' and other requisite documents for claiming such transferred Shares and unpaid dividend from the IEPF Authority. Please note that no claim shall lie against the Company in respect of unclaimed dividend amounts and the shares transferred in favour of the IEPF Authority pursuant to the said Rules.

In order to enable sending of notices and other statutory communications/ benefits to shareholders in electronic form, we request the shareholders of the Company, who have not yet registered their e-mail address, PAN No. and bank account details, to register the same in respect of equity shares held in electronic form with the concerned Depository through their Depository Participant(s) and in respect of shares held in physical form by writing to the Company or its Registrar and Share Transfer Agent M/s KFin Technologies Limited (Unit: PI Industries Ltd.) Selenium Tower B, Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad - 500 032. Attn: Mr. N. Shiva Kumar, Toll Free No. 1800-4258-998. Email: enward.ris@kfinetech.com; website: www.kfintech.com

The concerned shareholders are requested to claim their unclaimed/unpaid dividend amounts on or before 22 November 2024. In case the Company does not receive any communication from the concerned shareholders by 22 November 2024, the Company shall, with a view to complying with the requirements set out in the Rules, dematerialise and transfer the shares to IEPF Authority by way of corporate action by the due date as per procedure stipulated in the Rules without any further communication to the concerned shareholders.

For PI Industries Limited
Sd/-
Sonali Tiwari
Company Secretary & Nodal Officer

Place: Gurugram
Date: 23.09.2024

SANDESH

સગીરા સાથેની વાતચીતનો ઓડિયો આરોપીને વાયરલ કર્યો હતો આદિપુરમાં પોકસો એક્ટના આરોપીને કોર્ટ દ્વારા એક વર્ષની સજા ફટકારાઈ

સગીરા સ્કૂલે જતી ત્યારે આરોપી ભાઈકથી પીછો કરતો

1 ભૂજ 1 (શ્રેણ પ્રતિનિધિ) આરોપી જણે વેલાબાઈ ક્રોડયાને આદિપુરમાં પોકસો એક્ટના આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. આ આદિપુરમાં પોકસો એક્ટના આરોપીને એક વર્ષની સજા ફટકારી છે.

સગીરાનો મોબાઇલ બંધ કરી નાખ્યો હતો તેથી આરોપી સગીરા સ્કૂલે જતી હતી ત્યારે પીછો કરતો હતો. આ આદિપુરમાં પોકસો એક્ટના આરોપીને એક વર્ષની સજા ફટકારી છે.

આરોગ્ય નિષ્ણા (સાદી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - ભૂજ ૧, તા. ભૂજ)

સાદી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - ભૂજ ૧ તા. ભૂજ-૬૪૪ તા. ભૂજ સરખેર-૨૦૨૨ થી નીચે-૨૦૨૫ સુધી નીચે મુજબની યાદા તેલોલોટરી સામાન્ય ભાવ (નામ સ્વરાજ સાથે) સરખેર એ.ડી. માફ્ટને બંધ કરવાની નીચેના સરનામો મંગાવવાનો છે.

દવા અને લેબોરેટરી સામાન્ય વ્યાજ

Table with 3 columns: S.N., દવા/બેન્ડો, સરખેર વ્યાજ, ભાવ (પેપીયા સાથે)

નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનોની પણ તાતી જરૂર હોવા પર ભાર મુક્યો સ્પાઈસ જેટનો સ્લોટ રદ કરીને અન્ય અરલાઇન્સને આપવા ચેમ્બરની માગ

મુંબઈથી કંડલા ફ્લાઈટ અવારનવાર અચાક રદ કરાતો પ્રવાસીઓને મુશ્કેલી

સ્પાઈસ જેટની અનિયમિત સેવાના પગલે તેનો સ્લોટ રદ કરીને અન્ય અરલાઇન્સને આપવા માટે ગાંધીધામ ચેમ્બર અને કોમર્સ ટ્રાઈબ્યુનલ દ્વારા અરજીઓ રજૂ કરાઈ રહી છે.

ગાંધીધામ ચેમ્બર અને કોમર્સ ટ્રાઈબ્યુનલ દ્વારા અરજીઓ રજૂ કરાઈ રહી છે. સ્પાઈસ જેટની અનિયમિત સેવાના પગલે તેનો સ્લોટ રદ કરીને અન્ય અરલાઇન્સને આપવા માટે ગાંધીધામ ચેમ્બર અને કોમર્સ ટ્રાઈબ્યુનલ દ્વારા અરજીઓ રજૂ કરાઈ રહી છે.

ગાંધીધામના મહેરુવની નગર વિસ્તારમાં ખુલ્લી ગટરની ચેમ્બરમાં ગાય પડી ગઈ



ગાંધીધામના મહેરુવની નગર વિસ્તારમાં ખુલ્લી ગટરની ચેમ્બરમાં ગાય પડી ગઈ

ગાંધીધામના મહેરુવની નગર વિસ્તારમાં ખુલ્લી ગટરની ચેમ્બરમાં ગાય પડી ગઈ. આ અંગે ગાંધીધામ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે.

Advertisement for Divisa Ayurvedic Face Cream & Face Washes. Features a woman's face and product images. Text includes 'FRESH, Clean & Healthy SKIN' and 'Ayurvedic Face Wash Available in: 3 Variants'.

Advertisement for 'પોલીસ હાથ વેટરની તબીબને બોલાવીને માંસની ખરાબ કસાય ગાંધીધામમાં ૩૦ કિલો ગોમાંસ સાથે મહિલા સહિત બે પકડાયા'. Includes details about the incident and the individuals involved.

Advertisement for GMDC (Gujarat Mineral Development Corporation Ltd.) regarding the supply and replacement of spares for boiler and ESP. Includes contact information and website details.

Advertisement for OCCL (Oil Company of India) regarding the recruitment of 1000 employees. Includes details about the exam process and application information.

Advertisement for Gujarat Mineral Development Corporation Ltd. regarding the supply and replacement of spares for boiler and ESP. Includes contact information and website details.

Advertisement for Gujarat Mineral Development Corporation Ltd. regarding the supply and replacement of spares for boiler and ESP. Includes contact information and website details.

Advertisement for Gujarat Mineral Development Corporation Ltd. regarding the supply and replacement of spares for boiler and ESP. Includes contact information and website details.

Advertisement for Gujarat Mineral Development Corporation Ltd. regarding the supply and replacement of spares for boiler and ESP. Includes contact information and website details.

Advertisement for Gujarat Mineral Development Corporation Ltd. regarding the supply and replacement of spares for boiler and ESP. Includes contact information and website details.

Advertisement for Dhollera Industrial City Development Limited (DICDL) regarding the development of an industrial city. Includes details about the project and contact information.